



PAQ-001-001552

Seat No. _____

B. A. (Sem. V) (CBCS) Examination

October / November - 2018

Economics : Paper - 11 (Core)

(Micro Economics - I)

(Old Course)

Faculty Code : 001

Subject Code : 001552

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

- સૂચના : (૧) આંતરિક વિકલ્પના આધારે બધા પ્રશ્નોના ઉત્તરો આપો.
(૨) જમણી બાજુના આંકડા જે તે પ્રશ્નનાં પૂરા ગુણ દર્શાવે છે.
(૩) જરૂર જણાય ત્યાં આકૃતિનો ઉપયોગ કરો.

- ૧ એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર વર્ણવો. ૧૪
અથવા
૧ ઘટતા સીમાંત તુષ્ટિગુણનાં નિયમ દ્વારા ગ્રાહકની સમતુલા સમજાવો. ૧૪
૨ તટસ્થ રેખા એટલે શું ? તેના કોઈ પણ બે લક્ષણો આકૃતિ દ્વારા જણાવો. ૧૪
અથવા
૨ કિંમત અસર અને આવક અસર વિગતે સમજાવો. ૧૪
૩ કિંમત રેખા એટલે શું ? આકૃતિ મદદથી સમજાવો. ૧૪
અથવા
૩ માંગની મૂલ્યસાપેક્ષતાના પ્રકારો સમજાવો. ૧૪
૪ માંગની મૂલ્યસાપેક્ષતાને અસર કરતાં પરિબળોની ચર્ચા કરો. ૧૪
અથવા
૪ માંગરેખા પર કોઈ એક બિંદુએ મૂલ્યસાપેક્ષતાને કેવી રીતે માપી શકાય ? ૧૪
ઉદાહરણ સહિત સમજાવો.

- ૫ ટૂંકનોંધ લખો : (કોઈ પણ બે) ૧૪
- (૧) એકમલક્ષી અર્થશાસ્ત્રની ઉપયોગિતાઓ
- (૨) કુલ તુષ્ટિગુણ અને સીમાંત તુષ્ટિગુણ
- (૩) કિંમત રેખા
- (૪) માંગની મૂલ્યસાપેક્ષતાનો વ્યવહારિક ઉપયોગ.

ENGLISH VERSION

- Instructions :**
- (1) Answer all the questions on the basis of internal option.
- (2) Right side figures indicate full marks of the question.
- (3) Draw a diagram wherever necessary.
- 1 Describe the scope of micro economics. 14
- OR**
- 1 Explain the consumer equilibrium with the help of law of diminishing marginal utility. 14
- 2 What is indifference curve ? Discuss any two characteristics of it with the help of diagram. 14
- OR**
- 2 Explain the income effect and price effect. 14
- 3 Explain the price line ? Explain it with the help of the diagram. 14
- OR**
- 3 Explain the types of elasticity of demand. 14
- 4 Discuss the factors affecting elasticity of demand. 14
- OR**
- 4 How can elasticity of demand be measured on a point of demand line ? Explain with illustration. 14
- 5 Write short notes : (any two) 14
- (1) The usefulness of micro economics
- (2) Total utility and marginal utility
- (3) Price curve
- (4) The practical use of elasticity of demand.